

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૮/૧૧/૨૦૧૭ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૩૯૫/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૭૩ કેસ કરી, ૬૭ વ્યક્તિઓને ઝડપી, ૩૨૯ લીટર દેશી દારૂ, ૨૦૬ બોટલ ઈંગ્લીશ દારૂ અને ૦૧ કાર કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૦૨ કેસ કરી ૦૯ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૫,૩૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૩૯૬/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૩૮૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૬૪ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ ચોરી :-

સમાચાર યાદી નં.૨૩૯૭/૧૭

નરોડા : કિરીટભાઈ ચીમનલાલ સોલંકી (ઉ.વ.૫૭)(રહે,ભગવતીનગર રોહાઉસ કોતરપુર સરદારનગર) એ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૭/૧૧/૧૭ ના ક્લાક ૬/૫૦ વાગ્યા દરમિયાન નરોડા, ધીયાનગર દિપીકા ટાવરની બાજુમા મ.નં.૧, દેના બેક ખાતે કોઈ અજાણી વ્યક્તિ દેના બેંકમા બાથરૂમના વેન્ટિલેટરના સળીયા તોડી અંદર પ્રવેશ કરી, બેંકના સિક્યુરીટીમેનની ડબલ બોરલ બાર બોર ૨૮૭૫૧૦૯ નંબરની લાયસન્સવાળી ગન હાલની કિંમત રૂપિયા ૧૫,૦૦૦/- ચોરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એ.વાઘેલા ચલાવે છે.

અમરાઈવાડી : અજયભાઈ દિનેશભાઈ દવે (ઉ.વ.૨૭)(રહે,સારથી પરિસર રામોલ રિંગ રોડ અદાણી સર્કલ પાસે રામોલ) એ અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૭/૧૧/૧૭ ના રાતના ૯/૦૦ થી તા.૨૮/૧૧/૧૭ સવાર ૮/૦૦ વાગ્યા દરમિયાન કોઈપણ સમયે અમરાઈવાડી એક્સા શોપિંગ સેન્ટરમાં આવેલ પોતાની દિનેશ ઇલેક્ટ્રોનિક નામની દુકાનમાં અજાણી વ્યક્તિ પ્રવેશ કરી, એલ.ઇ.ડી. ટી.વી. નંગર કુલ કિંમત રૂપિયા ૩૨,૦૦૦/- ચોરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એમ.તેજોત ચલાવે છે.

નજર ચુકવી ચોરી :-

સમાચાર યાદી નં.૨૩૯૮/૧૭

ચાંદખેડા : સંદિપભાઈ જીતેન્દ્ર પ્રસાદ જયસ્વાલ (ઉ.વ.૨૭)(રહે,વું દાવન ડુપ્લેક્ષ નિરવ પેલેસની પાસે ચાંદખેડા) એ તા.૨૭/૧૧/૧૭ નારોજ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૯/૧૧/૧૭ રાતના ૧૧/૩૦ વાગ્યાનાં સુમારે ચાંદખેડા, અવનીભવનની બાજુમા, પાલીવાલ બેન્કેટ હોલ ખાતે સંદિપભાઈની સગાઈના દિવસે તેમની માતા અંજુબેનની નજર ચુકવી બે અજાણ્યા ઇસમો (જેમના નામ સરનામા ની ખબર નથી તે)એ ભેગામળી અંજુબેનની પાસે રાખેલ પર્સની ચોરી કરી લઈ ગયા હતા. જે પર્સમાં રોકડ રૂપિયા ૩,૦૦,૦૦૦/-, સગાઈમાં આવેલ ભેટ-સોગાદ રૂપિયા ૬,૦૦૦/- તથા એક નોકીયા કંપની નો મોબાઇલ કિંમત રૂપિયા ૫૦૦/- મળી કુલ રૂપિયા ૩,૦૬,૫૦૦/- ની મતા મુકેલ હતી. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એલ.સોલંકી ચલાવે છે.

દાઝી જતાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૨૩૯૯/૧૭

વટવા : અફસાનાબનુ વા/ઓ મોહમદયુનુસભાઈ શેખ (ઉ.વ.૩૫)(રહે,વસંત ગજેન્દ્ર ગડકરનગર ચાર માળીયા વટવા) તા.૨૧/૧૧/૧૭ ના કલાક ૭/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પ્રાઇમસ પર ચા બનાવતી વખતે અચાનક પ્રાઇમસ ફાટતા, કપડા ઉપર ઝાળ લાગતા, શરીરે ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે તેમને એલ.જી.હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૨૮/૧૧/૧૭ ના કલાક ૫/૦૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યુ હતુઆ અંગે વટવા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી રમેશભાઈ મુળજીભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.